

માનસિક વિવારણા

અની આપણી



મગજ અને
માનસિક શોગ
અંગેની
માહિતી આપતુ
ત્રિમાસીક
મેગેઝીન

તંત્રી : ડૉ. આઈ. જી. રત્નાણી

Vol : 2 Issue : 1 Quarterly Price Rs.12/-
January - March, 2018 BHAVNAGAR



www.psychiatristonline.blogspot.com

drijratnani@gmail.com



/DocRatnani



9925056695

અનુકમણીકા

૧. તંત્રી સ્થાને થી	૩
૨. અગોરાફોબિયા... “કર” એક લિમારી	૫
૩. પેટમાં ગેસ વાયુ અપચો (સચીત્ર)	૮
૪. Re - wire your Brain (Part-1)	૧૧
૫. “ડિપ્રેશન” એ માત્ર સામાન્ય “ઉદાસી” નથી	૧૪
૬. વાચકોના પ્રેણો	૧૭

Disclaimer

- ➡ અતે ચર્ચેલ રોગ, નિદાન અને સારવાર અંગેની સુચનાઓ માત્ર પ્રાથમિક સમજણ માટે છે. દર્દીના લક્ષણો, દવાની અસરો વગેરે દર્દીની તાસીર મુજબ હોઈ સારવાર માટે નિષ્ણાત તબીબનો અભિપ્રાય અનિવાર્ય છે.
- ➡ અતે દર્શાવેલ સુચનાઓને ડોક્ટરનો અભિપ્રાય માની લેવો નહીં.
- ➡ આ મેગેઝીન મગજ અને માનસિક રોગની જાગૃતી લાવવાનાં શુભ હેતુથી શરૂ કરેલ છે. આપના વાંચન બાદ અન્યોને વાંચવા આપી જન જાગૃતી અભીયાનમાં સહભાગી બનનું.
- ➡ મેગેઝીનમાં ચર્ચેલ કેસોમાં દર્શાવેલ દર્દીના નામો બદલીને લખેલ છે.

તંત્રી સ્થાને થી.....



“માનસિક સ્વાસ્થ્ય અને આપણો”

મેગેઝીન મારફતે માનસિક સ્વાસ્થ્ય અંગેની આપણી વાચન ચાત્રા આગળ ધ્યાવીશું. દરેક અંકમાં કોઈ એક માનસિક બિમારીનું સચિત્ર નિરૂપણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેને વાચકો તરફથી પણ ખુબજ સારો પ્રતિસાદ મળ્યો છે. આ અંકમાં “ઇરીટેબલ

બોવેલ સિન્ડ્રોમ” નામથી ઓળખાતી બિમારી જેમા પેટમાં ગેસ - વાયુ - અપચોની સમસ્યા મુખ્ય હોય છે. તેના ચિનહો અને માહિતીનું આલેખન કરવાનો પ્રયત્ન કરેલ છે.

આપણો **“ડિપ્રેશન”** શબ્દનો કોઈ કારણાસર મુડ ઉદાસ હોય કે કામનું તણાવ હોય ત્યારે મુડ દર્શાવવા છુટથી ઉપયોગ કરીએ છીએ. પરંતુ ડિપ્રેશનએ એક બિમારી છે. સામાન્ય ઉદાસી કરતાં ધણી ગંભીરતા દર્શાવતી બિમારી છે, આ વાતને પણ આ અંકમાં વણી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

જ્યારે **“ડર”** નું પ્રમાણ આપણા મન પર વધી જાય ત્યારે રોજુંદા જીવન પર દુષ્કર અસર પડે છે. વ્યક્તિ પોતાનું રોજુંદુ જીવન યોગ્ય જીવી શકતો નથી. તેને એકલા રહેતા કે બહાર જતા ડર લાગે છે અને ગભરાટ - બેચેનીનો અનુભવ થાય છે. જે **“ગાગોરાફોબીયા”** તરીકે ઓળખાય છે.

અંગ્રેજુ સેક્શનમાં વડોદરાના પ્રખ્યાત મનોધિકિલ્સક અને સાઇકોથેરાપિસ્ટ ડૉ. ઈલાબેન શર્માના આર્ટિકલ Rewire

your brain મારફતે “આપણે આપણા વિચારોને બદલી જાએ મગજની રચના અને કાર્યો બદલી શકીએ છીએ” ની ઐઝાનિક માહિતી મેળવીશું.

વાચકોના પોતાના “પ્રશ્નો” તેમજ “માનસિક સ્વાસ્થ્ય અને આપણે” મેગેઝીનની સોફ્ટ કોપી વોટ્સ-એપ કે ઈ-મેઈલ મારફતે મેળવવા 9925056695, કે drijratnani@gmail.com પર સંપર્ક કરવા વિનંતી છે.

આભાર સહ ...

ડૉ. આઈ. જે. રત્નાણી,
મગજ અને માનસિક રોગ નિધણાત
ભાવનગર, ૮૮૨૫૦૫૯૮૬૫
E-Mail : drijratnani@gmail.com

માનસિક સ્વાસ્થ્ય અને આપણે

મેગેઝીન નિયમીત મેળવવા માટે
આપનું નામ, સરનામુ અને મોબાઈલ નં.
9925056695 પર Whatsapp કરો.
તથા ઉપરોક્ત નંબર આપના મોબાઈલમાં સેવ રાખો.

૨. અગોરાફોબિયા... “કર” એક બિમારી

“કર” એ એક સામાન્ય લાગણી છે. લગભગ દરેક વ્યક્તિને તે અનુભવેલ હોય જ છે. યોગ્ય સમયે યોગ્ય પ્રમાણથી કરના સ્વયબ્ચાવ માટે જરૂરી છે તેમજ તે વ્યક્તિને બિનજરૂરી સાહસ કરતા અટકાવે છે. પરંતુ જો કરની માત્રા ખુબજ વધી જાય તો ? જો કરના લીધે તે પોતાની રોજ - બરોજની પ્રવૃત્તિઓ જ ના કરી શકે તો ? આપું જ કંઈક બન્યું અશ્વિનભાઈ સાથે.



લગભગ ચાતીસેક વર્ષનાં અશ્વિનભાઈ એક બિસ્કિટની કંપનીમાં સેલ્સમેનની નોકરી કરે છે. તેનું કામ જ કંઈક અવું કે તેણે નજીકના ગામોમાં ફરવું પડે અને માલને પહોંચાડવો પડે. માર્કેટીંગની નોકરી હોઈ લશ્યાંકને લઈને થોડું ટેન્શન પણ રહે. લગભગ ત્રણોક વર્ષ પહેલા રાત્રીના સુમારે તેઓ એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપતા હતા. ત્યારે તેને અચાનક જ છાતીમાં દુખાવા સાથે ઘબકારા વધી ગયા. પરસેવો થઈ ગયો, છાતીમાં ગભરામણ વધી થઈ, મોં સુકાવા લાગ્યું અને શ્વોરછોશ્વાસ ઝંઘાવા લાગ્યો, એમ જ લાગ્યું કે આ

જોરદાર હાઈ એટેક છે અને હવે પોતે જીવીત નહીં રહે. તેને ટાઈલીક એમબચ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પ્રાથમિક સારવાર બાદ તે ઓ સ્વસ્થ હતા. અને

- અગોરાફોબિયામાં વ્યક્તિ એવી જગાએ જતા કરે છે. જ્યાં ફસાઈ જવાના કે સલામત બહાર નિકળવાનો કર હોય.

ઇમરજન્સીમાં ડોકટરે
તેમને વધુ ટેન્શન ના
લેવાની સલાહ આપી
રહી આપી.

આ અચાનક
આવેલ ગભરાટ -
બેચેનીના હુમલાની

અસ્થિનભાઈ પર ઘણી જ પ્રતિકુળ અસર થઈ. મનમાં જાણો એક “ડર” બેસી ગયો કે “ફરી આ હુમલો આવશે તો ?” “પોતાને કંઈ થઈ જશે તો ?” તેઓ પોતે બહાર એકલા જવાનું ટાળતા. એટલે સુધી કે તેમને કામ પર જવામાં ખુબજ મુશકેલી પડતી. પોતે વર્ષોથી જે ગામડાઓમાં માર્કેટીંગ માટે જતા ત્યાં જતા જાણો કોઈ અજ્ઞાત ભય ઘેરી વળતો “કંઈ થઈ જશે તો ?” સાથે જ ગભરાટ - બેચેની વદ્ધી પડે, મોં સુકાવા લાગે, શ્વાસ રંધાવા લાગે. અને આ “ડર” થી પોતે બહાર નિકળી પોતાનું કામ કરી શકતા નથી. આથી, તેનો પંદર વર્ષનો પુત્ર પોતાનો અભ્યાસ છોડી પિતાની સાથે રહે છે. અને જો પુત્ર કે અન્ય કોઈ વ્યકિત સાથે હોય તો તેને આ “ડર”ની લાગણી ઘણી જ ઘટી જાય છે.

“સર હું આ તકલીફોના લીધે ખુબજ વ્યાકુળ છું. પાણ મારો તેના પર કાબુ નથી. છેલ્લા ત્રણ વર્ષથી હું આ “ડર”થી પરેશાન છું. મારા રોજુંંદા કાર્યો પણ હું સ્વસ્થતાથી કરી શકતો નથી. મારા પુત્રનો અભ્યાસ પણ છેલ્લા ત્રણ વર્ષથી મારી બિમારીના લીધે જ ખરાબ થઈ રહ્યો છે. પણ હું શું કરું ? આ બધીજ વાતો પર જાણો મારો કાબુજ નથી. મને ઘરની બહાર જતા પણ ડર લાગે. અરે ઘરમાં જ એકલા રહેતા પણ ડર લાગે. અને છેલ્લા ત્રણ વર્ષથી મેં કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી નથી. અગાઉ ધાર્મિક કાર્યક્રમોમાં મારી હાજરી અવશ્ય રહેતી. કોઈ લીડ વાળી જગ્ગા પર જવાની દરદી જ નથી થતી. અને ડર લાગે છે.

● દર્દીને ઘરમાં કે બહાર એકલા જતા
ડર લાગે લીડલાડ વાળી જગાએ
કે સામાજુક મેળાવડાઓમાં જતા ડર
લાગે આ ડરના લીધે પ્રવૃત્તીઓ અને
જીવન જાણો સંકોચાઈ જાય છે.

● દવાઓ ઉપરાંત ધીરે ધીરે કરનો સામનો કરવાની તાલીમ - જે “એકસપોઝર થેરપી” તરિકે ઓળખાય છે. વડે સારવાર આપવામાં આવે છે.

અ ઈ વ ન ભ । ઈ
“અગોરાફોબિયા” અર્થાત
“ભીડનો કે જાહેર સ્થળોનો
કર” નામથી મેડિકલની
ભાષામાં ઓળખાતી બિમારીથી
પિડાય છે. આ બિમારીમાં

વ્યક્તિ એવી જગાઓ પર જતા કરે છે. જ્યાં ફસાઈ જવાનો કે સલામત બહાર નિકળવાનો ભય હોય, કે અન્યોની હાજરીમાં શરમજનક રિથીમાં મુકાવાનો કે ગભરાટ - ચિંતા વધી જવાથી શ્વાસોરછવાસ - ઘબકારા વધી જવાનો હુમલો આવવાનો ભય હોય. આવી વ્યક્તિઓ આ બિમારીના લીધે પરાવલંબી બની જતી હોય છે. સતત કોઈની હાજરી જોઈએ. ઘરમાં કે બહાર એકલા જતા કર ના લીધે વ્યક્તિની પ્રવૃત્તિઓ અને જીવન જાણો સંકોચાઈ જાય છે. મોટાભાગે આ બિમારીની સાથે “પેનિક ડિસાર્કર” તરિકે ઓળખાતા ગભરાટ - ચિંતા ના હુમલાઓ જેવા મળે છે. ઘણા કેસમાં આવા એકાદ પેનિક એટેક બાદ જ બિમારીની શરૂઆત થઈ હોય છે. અને ત્યારબાદ બિમારી વધતી જાય છે.

મનોચિકિત્સકના સંપર્ક થી આ બિમારીની સારવાર શક્ય છે. દવાઓ વડે “પેનિક એટેક” ના હુમલાઓ નાખું કરવા શક્ય છે તથા એ આ સારવારનું પ્રથમ પગથિયું છે. એક વખત દવાઓ વડે પેનિક એટેક ના હુમલાઓ આવતા અટકે તથા ગભરાટ-ઘબકારા વધવા - બેચેની જેવા લક્ષણો માં ફાયદો મળ્યે કર પર કાબુ મેળવવાની સારવાર - જે “એકસપોઝર થેરપી” તરિકે ઓળખાય છે તેની શરૂઆત કરવાની રહે. આ સારવાર માં ધીરે-ધીરે કરનો સામનો કરવાની તાલીમ આપવામાં આવે છે. સારવાર થી મોટાભાગના કેસમાં દર્દી તદ્દન સાજો થઈ ફરી પહેલા માફક નોર્મલ જીવન જીવતો થઈ શકે છે.

* * * * *

3. પેટમાં ગેસ વાયુ અપચો (સથીત)

ઈરીટેબલ બોવેલ સિન્ડ્રોમ

અન્ય નામ

ફંક્શનલ ડિસ્પેષ્ઝિયા ● ફંક્શનલ બોવેલ ડિસીજ

લક્ષણો

પેટમાં ભરાવો -ભાર લાગવાનો અનુભવ.
થોડું જમ્યા પણી પેટ કુલી જવું કે ભારે થઈ જવું.


**ઓડકાર આવવાં .****પવન સ્ત્રાવ થવો.****ઉબકા - ઉલટી થવાં.**



પેટમાં દુઃખાવો થવો.
પેટમાં ચૂક આવવી.
વારંવાર જાજૃ જવું પડે કે કબજુયાત રહે.

કારણો

પેશીસ્ટાલસીસ : આંતરડાની નિયમીત લયબદ્ધ ગતિ વડે ખોરાક આંતરમાં ગતિ કરે છે. ઈરીટિબલ બોવેલ સિન્ડ્રોમ માં આ ગતિ ખૂબ વધી કે ઘટી જવાથી વારંવાર જાજૃ જવું -
કબજુયાત સહીત પેટમાં ગેસ
- વાચુ અપચોની સમસ્યા ઉદ્ભવે છે.



માનસિક બિમારીઓ ગેસ વાચુ અપચાની સાથો સાથો આંશિક રૂપે જોવા મળે છે.

ડિપ્રેશન, ઉદાસી, ગભરાટ, બેચેની, અનિક્રિએશન, આપદ્યાત નાં વિચારો કે પ્રચાસનનું પ્રમાણ રહે છે.

સારવાર

દવાઓ...

શું દ્યાન રાખવું “ઈરીટિબલ બોવેલ સિન્ક્રોમ” ના દર્દીઓએ દ્યાન માં રાખવા જેવી બાબતો :

૧. તીખા તળેલા, ધી- તેલ ચુકત પદાર્થોનું સેવન ના કરવું. ગેસ તકલીફ કરતા પદાર્થો જેવાકે દુધ-ડેરીની બનાવટો, કુંગળી, કોબીનો ઉપયોગ ઘટાડવો. છાસ દહી માપસર લઈ શકાય.
૨. તાજા ફળો, શાકભાજુ, ફાઈબર-રેસા વાળા પદાર્થોનો ખોરાકમાં ઉપયોગ વધારવો. (રેસાચુકત પદાર્થોનું પ્રમાણા ખોરાક માં ધીમે- ધીમે વધારવું.)
૩. દારૂ, સિગારેટ, કોઝી જેવા નશાચુકત પદાર્થોથી દૂર રહેવું.
૪. એકસાથે વધુ ખોરાક લેવાના બદલે થોડા- થોડા ટુકડાઓમાં ખોરાક લેવો. ધીરે- ધીરે નાના ટુકડાઓમાં ચાવીને ખાવું. જમતી વખતે પાણી પુરતા પ્રમાણમાં લેવું.
૫. જો બિમારી વધતી જણાય કે નવી તકલીફો જણાય તો તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક કરવો.

* * * * *

4. Re - wire your Brain (Part - 1)

Dr. Elavatsala Sharma

Psychiatrist & Psychotherapist

- Gotri, Vadodara.
- 📞 9925012454
- ✉️ drvatsalaela@gmail.com



In 1890, a psychologist, philosopher and physician named William James, first introduced the idea our thoughts can change the function and structure of our brain. This theory was ignored for the first half of the 20th century, until studies on stroke victims in the 1960's reported evidence of the brain re-wiring itself following damage.

Our brain is wired up in two major ways; through repetition and through strong emotional or physical experiences.

Repetition is creating and strengthening a pathway of information to the appropriate part of the brain. Recurrence of this activity strengthens the pathway and goes on to form a habit or an automatic behaviour.

Learning the alphabet is a form of repetition. So is learning to drive a car. The very first time you drove a car, you were creating new pathways in your brain. Over time you strengthened these pathways until you no longer have to think about every little motion of driving; it just comes naturally.



This is also why habits are hard to break.

If we think of these pathways like a very fine cotton thread, you can imagine how easy it is to break after only one time.

However, if you reinforce this pathway with three more repetition, the threads together are a little stronger. Each repetition adds another thread, and soon you'll have a thick, sturdy rope.

However, if something new and strongly emotional or physical happens, a pathway can be formed after just one experience.

Take an example of my friend feeling physically coupled with emotionally drained after having lemon pie. These feeling associated with rock solid pathway in my friend's brain that lemon pie makes you sick. The emotional and physical component was so strong that it didn't need repetition to strengthen it.

Unfortunately, our brain can wire up false information. My lovely friend knows in theory that lemon pie will not make her sick, but her brain believes it so thoroughly that both the thought and smell will make her stomach burn.

As we go through childhood and adolescence, our brains can wire up tons of information that is based on our experiences, but fundamentally isn't true.

For example, imagine a young boy who gets

completely confused about a simple question and gets it wrong in front of the whole class. Imagine the teacher gets angry, the whole class laughs someone behing him calls him a name.

Two things could happen; if that boy is confident and knows he's actually smart but just made a silly mistake; he might laugh it off with everyone Or, if that boy is vulnerable and is flooded with strong emotions like embarrassment and shame, those emotions might form pathways that say 'You are not smart' and 'Speaking out in front of people will cause shame and embarrassment'

Neither of which are true, but that boy has just formed a rock solid pathway.

Being neglected, abandoned, abused, teased, bullied, disrespected, lied to, cheated or hurt is all experiences that our brain can form strong, but false, pathways upon. Being rejected as a child can form a pathway that tells us 'You are not good enough'. This idea relationships and friendships along the way.

So, let's back to the good news - we can re-wire our brains.

Re-wiring your brain is much more involved than positive thinking hard. To create new neural connections in the brain. are five pathways that must be stimulated.

As we know with the cotton analogy, one thread alone is not strong enough to re-wire your brain. However, multiple threads added to often will soon give you a solid pathways that will result in lasting changes.

(To be Continued in next issue)

પ. “ડિપ્રેશન” એ માત્ર સામાન્ય “ઉદાસી” નથી



કોઈપણ આધાતજનક ઘટના
બાદ તેમાથી પાછા નોર્મલ
જીવન શરૂ કરતા સહેજે
થોડો સમય લાગે છે
અને આ આધાત
જ ન ક ઘટ નાની
માનવીના મન પર પણ

ગ । ૬ અસર થતી હોય છે. આ આધાતથી
વ્યક્તિ ઉદાસીમાં સરી પડે કે થોડો સમય કોઈ વાતમાં રસ ના લઈ
શકે તેમ પણ બને. આમ, જીવનના ચડાવ - ઉતાર દરમિયાન
વિષમ પરિસ્થિતીમાં લગભગ દરેક વ્યક્તિને ‘ઉદાસી’નો અનુભવ
કરેલ જ હોય છે. શું આ ‘ઉદાસી’ એ જ ડિપ્રેશન છે. ? ઘણી વખત
આ “ઉદાસી” અને “ડિપ્રેશન” વરયેનો લેદ ન પારખી શકાતા
પરિસ્થિતી વકરે છે.

પિતાનું અવસાન થતા મોહન શોકમાં સરી પડ્યો છે.
લગભગ એકાદ મહિનાથી તે અનિદ્રાનો ભોગ બજ્યો છે, વાત-
વાતમાં રડવા લાગે કે ઢીલો
પડી જાય. સતત નકારાતમક
વાતો કે પોતે જીવનનો કોઈ
અથ્ ન થી. ભ ખિ છ ય

• ડિપ્રેશનની ઉદાસી વ્યાપક,
એકધારી, લાંબો સમય ટકી રહેનારી
હોય છે. આંતરે - આંતરે પણ
આનંદ અનુભવાતો નથી.

- ડિપ્રેશનમાં વ્યક્તિને ભયિષ્ય અંધકારમય લાગે છે. આપદ્યાતનાં વિચારો રહે છે. અને તેના પર ગંભીરતાથી અમલ પણ કરે છે.

અંધકારમય છે. મારા માટે માત્ર જીવનનો અંત લાવવો એ જ તેનો પશ્ચાતાપ છે. આવતા જતા લોકો સાંત્વના આપતા જાય અને

ધીરજથી કામ લેવાની સલાહ આપે ભાગ્યે જ કોઈએ મોહનની માનસિક સ્થિતીને ગંભીરતાથી લીધી, બધાએ મોહનની હાલની પરિસ્થિતીએ પિતાના અવસાન બાદની સામાન્ય શોકાતુર પરિસ્થિતી માની લીધી કે સમય જતા બધું બરાબર થઈ જશે. વિનોદકાકાએ તો પોતાના પિતાના અવસાન સમયની વાતો વાગોળી કે પોતે પણ ‘ઉદાસ’ હતા પણ ધીરે - ધીરે બધું જ સામાન્ય થઈ ગયું. અને અચાનક એક રાતે મોહને ગળાફાંસો ખાઈ આપદ્યાત કર્યો.

મોહન જેવી માનસિક પરિસ્થિતીમાંથી પસાર થતા લાખો લોકો નજીકના સગા-સનેહીઓના અવસાન બાદ, પરીક્ષા કે દંધા - વ્યવસાય નિષ્ફળતા બાદ, લગ્ન જીવનની નિષ્ફળતા બાદ પસાર થતા હોય છે. અને આવા બનાવો દરમિયાન સામાન્ય “ઉદાસી”નો અનુભવ થવો સ્વાભાવિક છે. આ સામાન્ય “ઉદાસી”ને “ડિપ્રેશન” જેવી ગંભીર બિમારીથી અલગ તારવવી ખુબજ જરૂરી છે.

“ડિપ્રેશન” દરમિયાન અનુભવાતી ઉદાસી વ્યાપક અને એકદ્યારી લાંબો સમય ટકી રહેનારી હોય છે. આ દરમિયાન આંતરે - આંતરે કોઈપણ આનંદ દાયક પળો દરમિયાન પણ આનંદ માણી

● નજુકનાં સનેહીનાં મૃત્યુ કે
દુઃખની ઘટના બાદ હું આ ઘટના
માટે જવાબદાર છું. ની લાગણી
ડિપ્રેશનનો સંકેત કરે છે.

શકાતો નથી. ધારી વખત સનેહીઓ
“અમો આમને હસાવવાનો ધારો
પ્રયત્ન કરીએ છીએ પણ તેઓ
હસતા જ નથી” જેવી વાતથી

નિરૂપે છે. સામાન્ય ઉદાસી દરમિયાન વ્યક્તિને આપદાતના કે
ભવિષ્ય અંદરકારમય લાગવાના વિચારો નહિવત રહે છે અને
વ્યક્તિ તેના પ્રત્યે ગંભીર હોતો નથી. નજુકના સનેહીના અવસાન
બાદ “જો એ હ્યાત હોત તો સારુ થાત” એવી લાગણી દરેક
ઉદાસ વ્યક્તિ અનુભવે છે. પરંતુ “હું એ ઘટના માટે જવાબદાર છુ
આથી સજાને પાત્ર છુ.” એ વાત સામાન્ય ઉદાસી માટે અજુગતી
છે જે કંઈક ગંભીર ડિપ્રેશનનો સંકેત કરે છે.

“ઉદાસી” એ એક સામાન્ય માનવ સહજ લાગણી છે જે
લગભગ દરેક મનુષ્યએ કચારેક ને કચારેક અનુભવેલી જ હોય છે. તે
દુઃખદાયી છે અને તે લગભગ સમય જતા ઓછી થાય છે કે જતી રહે
છે. જ્યારે “ડિપ્રેશન” એ એક માનસિક બિમારી છે. તે માત્ર
દુઃખદાયી લાગણીથી ધારું જ ગંભીર જાણે જીવન - મરણનો પ્રશ્ન
છે. તે સારવાર વિના જતું નથી. તેની વ્યક્તિતના રોજુંદા જીવન,
કાર્યક્ષમતા, ઉંઘ, ભુખ, એકાગ્રતા, ઉત્પાદકતા, વિચારશક્તિ,
નિર્ણયશક્તિ પર ગંભીર અસર પડે છે તથા સારવાર વિના
ડિપ્રેશનમાં બિમારી વધુ વકરવાના કે
આપદાત જેવા જોખમી પરીણામોને
અવકાશ રહે છે.

● સારવાર વિના ડિપ્રેશન વધુ
વકરવાનો કે આપદાતનો
અવકાશ રહે છે.

* * * * *

૬. વાચકોના પ્રેણો

Q. સેકસ સમસ્યાની સારવાર માટે રોજ છાપાઓમાં હર્બલ દવાઓ - તેલ વગેરેની જાહેરાતો પ્રકાશિત થતી હોય છે, તેની અસરકારકતા તેમજ આડઅસરો બાબતે માહિતી આપશો.

ANS: સે ક સ પા પ ર
વધારવાની, સેકસનો સમય
વધારવાની, સ્ટે મીના
વધારવાની અને ઈન્ડ્રીયની
લંબાઈ વધારવાના વિવિધ
દવાઓ તથા યંત્રોની જાહેરાત
આજ - કાલ છાપાઓમાં બહુ
જ આવે છે. અને આ વ્યવસાય પણ ખાસ્સો કુલ્યો ફાલ્યો છે.



ઘોડે જેસી
સેકસ શક્તિ
પાને કા
રામબાળ
નુસ્ખા

મોટાભાગે આ પ્રકારની દવાઓમાં તેઓ કયા રસાયણોનો ઉપયોગ કરે છે. તેની વિગતો આપવામાં આવતી નથી. અને માત્ર “હર્બલ મેડીસિન - આડ અસર રહિત” એટલું જ લખેલ હોય છે અને તેના પર કોઈ અશ્વ કે આખલાનું ચિત્ર હોય છે. જે સેકસ પાવરના પ્રતિક તરીકે વાપરવામાં આવે છે.

ધણી વખત સેકસ ટોનિકમાં “opium” અર્થાત “અફીણ” નો ઉપયોગ થતો હોય છે અને તેના વારંવારના સેવનથી તે અફીણના વ્યસની થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત કેટલાક સેકસ ટોનિક માં “સર્પગંધા” નમની ઓષધીનો ઉપયોગ થતો હોય છે. જેમાં “રિક્રિન” નામનું રસાયણ હોય છે. જેના વધુ પડાતા ઉપયોગથી ડિપ્રેશન નામની બિમારી થવાનું

• સેકસ ટોનિકથી થતો ફાયદો તેમાં રહેલ દવાનાં તત્ત્વ કરતા તેના પેકેટ પર દોરેલ અશ્વ કે આખલાના ચિત્ર દ્વારા થતો સાઇકોલોજિકલ ફાયદો છે.

જોખમ રહે છે.

પ્રખ્યાત સેક્સોલોજીસ્ટોનાં
મંતવ્ય મુજબ “ સેક્સ ટોનીકનો

● બજારમાં મળતી સેક્સની દવાઓ
અને સેક્સ ટોનીકનું સેવન જોખમી
સાબીત થઈ શકે છે.

ફાયદો હકીકતમાં તેમાં રહેલ દવાના

તત્વ કરતા તેના પર દોરેલ અંશ્વ કે આખલાના ચિત્રથી વધુ થાય છે.”
અર્થાત આ સેક્સ ટોનીક વડે અનુભવાતો ફાયદો એ માત્ર સાચકોલોજીલ
ફાયદો છે. તે દવાને લીધે થતો સાચો ફાયદો નથી.

એક સેક્સ થેરાપિસ્ટના જણાવ્યા અનુસાર, કેટલાક દર્દીઓ
કંઈક તાત્કાલીક અસરકારક દવાઓ કે જડિબુઝીની આશા સાથે ડોક્ટર
પાસે આવે છે. અને તેઓ થોડી સમય માગી લેતી સેક્સ થેરપી માટે તૈયાર
હોતા નથી. આથી તેઓ ઘણી વખત ઓવર ધ કાઉન્ટર (ડોક્ટરના
પ્રિસ્ક્રીપ્શન વિના સીધી જ દવાની દુકાને થી મળતી) મળતી સેક્સ
ટોનીક ના ચક્કરમાં ફસાઈ જાય છે.

આવી લેભાગું જાહેરાતોથી ભમાઇને તેમાં ફસાવાથી ઘણી વખત
ફાયદો થવાને બદલે નુકશાન વધુ થાય છે. વ્યકિત સેક્સ એજયુકેશન
મેળવી ગેર માન્યતાઓના લીધે ઉદ્ભબતી સેક્સ સમસ્યાઓથી છુટકારો
મેળવી શકે છે. અને આ ઉપરાંત પણ જો તે કોઈ સમસ્યાથી પિડીત હોય
તો તેણે વિના સંકોચે કોઈ કવોલીફાઈડ સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરવો
જોઈએ.

પુર્ણવિરામ પ્રેમાણ સાથી જ સર્વશ્રેષ્ઠ સેક્સ ટોનીક છે.

વાયકોના પ્રશ્નો
કોલમ માટે આપ પણ
આપના પ્રશ્નો
પૂછી શકો છો.

ડૉ. આઈ. જે. રત્નાણી

મગજ અને માનસિક રોગ નિષ્ણાત

9925056695

drijratnani@gmail.com

મગજ અને માનસિક રોગોના પ્રકાર અને લક્ષણો

- માથાનો દુઃખાવો, માઈશેન, આધાશીશી
- ડિપ્રેશન, ઉદાસી, યિંતા, ગભરાટ, બેચેની
- પેટમાં ગેસ-વાયુ - અપચો
- ફેર-ચક્કર, કારણ વગર ડર લાગવો
- શરીરના જુદા-જુદા ભાગોમાં થતા દુઃખાવા
- આંચકી, વાઇ હિસ્ટેરીયા
- સ્કિઝોફેનિયા, ઉન્માદ (મેનિયા) તથા સ્મૃતિભંશ (ડેમેન્શિયા)
- અનિદ્રા, વિચારવાયુ, ધૂનરોગ
- સેકસ સમસ્યા
- બાળકો તથા તરણોનું પથારીમાં પેશાબ કરવું

ડૉ. આઈ. જે. રત્નાણી

MBBS, MD, PGDS, MIPS

મગજ અને માનસિક રોગ નિષ્ણાત

ઓજસ ન્યુરોસાઇક્લિયાટ્રી ક્લીનિક

સેકન્ડ ફ્લોર, શ્રી મહી પ્લાઝા, કાળુભા રોડ,
કાળાનાળા, ભાવનગર- ૩૬૪૦૦૧

સમય સવારે ૧૧ થી ૧, સાંજે ૬ થી ૮

૭ 9978739359

MANSIK SVASTHYA ANE AAPANE

માનસિક સ્વાસ્થ્ય અને આપણે

Printed Matter

Book-post

તરી
ડૉ. આઈ. એ. રચનાથી
 માગજ અને માનસિક રોગ નિષ્ટાત
 શ્રી ભાગી પ્રાંત, કાળુલા રોડ,
 કાળાનગર, લાખનગર- ૩૬૪૦૦૧.
₹ ૮૮૯૮૯૩૬૩૫૬



Printed Published, Owned and Edited by I. J. RATNANI
 Printed at Vanshika Forms, F-12, Sanghvi Plastic Compound, Tekari Chowk,
 Ruvapari Road, Bhavnagar, Gujarat, India Pin-364001
 Published at Bapu Mehta Street, Amba Chowk, Bhavnagar, Gujarat, India Pin-364001
 Editor : I. J. RATNANI